

📍 514, Maple Trade Center, Near Surdhara Circle, Thaltej, Ahmedabad.
☎ +91 70690 33438 • 1800 123 3699 ✉ sales@prizor.in 🌐 www.prizor.in

CIN : L26401GJ2017PLC095719

Letter No.: PVL/039/2025-26

Date: October 10, 2025

To,
Listing Compliance Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, C-1, Block G,
Bandra Kurla Complex,
Bandra (E)
Mumbai – 400 051

NSE SYMBOL: PRIZOR
ISIN: INE0V9N01017

Subject: Intimation of publication of newspaper advertisement in respect of Extraordinary General Meeting of the Company.

Dear Sir/ Madam,

Pursuant to Regulation 47 and Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of newspaper advertisement confirming dispatch of notice of First Extraordinary General Meeting of FY 2025-26, as published in newspapers viz. Financial Express (English) and Financial Express (Gujarati) respectively, today i.e. 10th October, 2025.

Please take the same in your records and do the needful.

Thanking You,

Yours Faithfully,
For, Prizor Viztech Limited

Mitali Gauswami
Managing Director
DIN: 07712190

Encl: a/a

**JINDAL POLY FILMS LIMITED**
(CIN No. L17111UP1974PLC003979)
Regd. Off.: 19th K.M., Hapur-Bulandshahr Road, P.O. Gulaothi, Distt. Bulandshahr, U.P. - 245408
Corp. Off.: Plot Number - 87, Sector 32, Institutional Area, Gurugram, Haryana - 122001
Phone: 0124-6925100
Email: cs_ipoly@jindalgroup.com. Website: www.jindalpoly.com

NOTICE TO SHAREHOLDERS
1. 100 Days Campaign- "Saksham Niveshak" - for KYC and other related updation to prevent transfer of Unpaid / Unclaimed dividends to Investor Education and Protection Fund (IEPF).
Notice is hereby given that, the Investor's Education and Protection Fund Authority (IEPFA), Ministry of Corporate Affairs (MCA) by its circular dated 16th July, 2025 has requested Companies to launch a 100 days Campaign- "Saksham Niveshak", to reach out to shareholders whose dividend remain unpaid/unclaimed. The shareholders are informed that the objective of this Campaign is to facilitate the updating of KYC details of the Shareholders of the Company. Those shareholders who wish to update their KYC details are requested to download the KYC updation forms from <https://www.jindalpoly.com/download-reports> and to submit the duly filled and signed forms along with KYC documents to the Registrar and Share Transfer Agent (RTA) at following address: KFin Technologies Limited, Selenium Tower B, Plot Nos. 31 & 32, Financial District, Nanakramguda, Serlingampally Mandal, Hyderabad - 500032, TELANGANA. **Website:** www.kfintech.com E-mail: suresh.d@kfintech.com Tel: 040-67162222
Further, Shareholders holding shares in Dematerialized form are requested to contact their respective Depository Participant (DP) to update the KYC details. Details of the shareholders whose dividend was transferred to Unpaid Dividend Account are made available on the website of the company at <https://www.jindalpoly.com/download-reports>. In accordance with the same, during this 100 Days campaign from 26th July, 2025 to 06th November, 2025 all the eligible shareholders are requested to update their KYC details at the earliest in order to claim their unclaimed dividends and prevent their shares and dividend amount from being transferred to the IEPF Authority. To support the success of this campaign, it is requested to submit the documents before 6th November, 2025.
2. SPECIAL WINDOW FOR RE-LODGE MENT OF TRANSFER REQUEST OF PHYSICAL SHARES.
Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoP/CIR/2025/97, dated July 02, 2025, the Company is pleased to offer one-time special window for physical shareholders to submit re-lodgment requests for the transfer of shares. The Special Window will be open from July 07, 2025 to January 06, 2026 and is applicable to cases where original share transfer requests were lodged prior to April 01, 2019 and were returned/unattended or rejected due to deficiencies in documentation, process or any other reason. The shares re-lodged for transfer will be processed only in dematerialized form during this window. Eligible shareholders may submit their transfer requests along with the requisite documents to the Company's Registrar and Share Transfer Agent (RTA) KFin Technologies Limited, Selenium Tower B, Plot Nos. 31 & 32, Financial District, Nanakramguda, Serlingampally Mandal, Hyderabad - 500032, TELANGANA.
UPDATE KYC AND CONVERT PHYSICAL SHARES INTO DEMAT MODE.
The Shareholders who are holding shares in physical form are requested to update their, KYC and also requested to convert their physical share Certificates in to dematerialized form (electronic form). The shareholders are also requested to claim their unclaimed dividend amounts, otherwise, the same will be transferred to Investor Education and Protection Fund Authority (IEPFA) after expiry of seven years along with the Shares thereon timely.

By order of the Board of Directors
Jindal Poly Films Limited
Sd/-
Ashok Yadav
Company secretary
ACS: 14223

Date : 09th October, 2025
Place : Gurugram

**PRIZOR PRIZOR VIZTECH LIMITED**
Regd. Office: 514, Maple Trade Centre, Nr. Surdhara Circle, Thaltej, Ahmedabad, Gujarat, India, 380054 Tel No.: +91 78618 04737; Email: investors@prizor.in; Website: www.prizor.in

NOTICE OF FIRST EXTRA ORDINARY GENERAL MEETING OF FY 2025-2026 AND E-VOTING INFORMATION
Notice is hereby given that the First Extra Ordinary General Meeting (EGM) of the Members of the Company "Prizor Viztech Limited" ("Company") (CIN: L26401GJ2017PLC095719) is scheduled to be held on Saturday, November 01, 2025 at 05:30 P.M. IST through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM), to transact the businesses as set out in the Notice of EGM pursuant to the General Circular No. 09/2024 dated September 19, 2024, issued by the Ministry of Corporate Affairs (MCA) read with circular issued by SEBI vide circular no. SEBI/HO/CFD/CFDPO-2/P/CIR/2024/133 dated October 3, 2024.
Notice of EGM is dispatch to all the eligible members whose e-mail address are registered with the Depository Participants (DPs) / Company / Registrar & Transfer Agent of Company through electronic mode only and the physical copy of the EGM Notice will not be sent separately to any shareholder.
The businesses as mentioned in the Notice of EGM may be transacted through e-voting facility to enable the eligible members to cast their votes electronically and accordingly Company has engaged the services of NSDL to provide remote e-voting facility and e-voting facility during the EGM to the eligible members of the Company. The Notice of EGM is published on the website of NSDL's at www.evoting.nsdl.com and on Company's website at www.prizor.in.
The members can participate in the Extra Ordinary General Meeting **ONLY** through **VC/OAVM facility**. The details of which is provided by the company in the Notice of the Meeting. Accordingly, no provision had been made to enable the shareholders to attend and participate in the EGM of the company in person. Members attending the EGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Companies Act, 2013.
The details required under Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standard issued by ICSI, are mentioned below:
1. The Special Businesses as set out in the Notice of EGM may be transacted through voting by electronic means only, which is detailed in the Notice;
2. The cut-off date for determining the eligibility to vote by electronic means is Saturday, October 25, 2025;
3. The remote e-voting of the Company shall commence on Wednesday, October 29, 2025 from 09.00 A.M. IST and end on Friday, October 31, 2025 at 05.00 P.M IST. The remote e-voting shall not be allowed beyond the aforesaid date and time. Once the votes are cast by the members the same cannot be changed by them;
4. A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the Depositories as on the cut-off date i.e. Saturday, October 25, 2025, shall only be entitled to avail facility of remote e-voting or e-voting at the EGM;
5. A person, who acquires the shares and becomes a shareholder of the company after the dispatch of the Notice and holds shares as on the cut-off date i.e. Saturday, October 25, 2025, may follow the procedure for obtaining User ID and Password as provided in the Notice of the Meeting which is available on the website of the company and on NSDL's website. If the Shareholder is already registered with NSDL for e-voting then he/she can use his/her existing user ID and Password for casting the vote through remote e-voting;
6. The members who have cast their vote through remote e-voting prior to the EGM may also attend the EGM through VC and OAVM but shall not be entitled to cast their vote again;
7. The Company has appointed Ms. Insiya Nalawala, Practicing Company Secretary, as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner; Members are requested to note that pursuant to the MCA and SEBI circulars, the company will not be sending physical copies of EGM Notice to the members of the company.
In case of any queries or issues regarding e-voting, members are advised to refer the "FAQ" and "E-Voting user manual" available at www.evoting.nsdl.com or write an email to evoting@nsdl.co.in
In case of any grievance connected with facility for voting by electronic means members may contact to Ms. Hetaxi Bhatt, Company Secretary of the Company, Contact Number: +91 78618 04737, Email Id: investors@prizor.in, Address: 514, Maple Trade Centre, Nr. Surdhara Circle, Thaltej, Ahmedabad, Gujarat, India, 380054.

By order of the Board of Directors
For, Prizor Viztech Limited
Sd/-
Mitali Gauswami
Managing Director and Chairman
DIN: 07712190

Place: Ahmedabad
Date: 09.10.2025

"IMPORTANT"
Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

**MUTUALFUNDS**
Sahi hai
**uti**
UTI Mutual Fund
Haq, ek behtar zindagi ka.

NOTICE
Hosting of the half-yearly statement of schemes portfolio of UTI Mutual Fund
NOTICE is hereby given to all Unit holder(s) of UTI Mutual Fund "Schemes" that in accordance with Regulation 59(A) of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 and Circulars issued by SEBI from time to time, The half-yearly statement of schemes portfolio of all Schemes for the Half year ended September 30, 2025 have been hosted on our website viz. www.utimf.com, and on website of AMFI viz. www.amfiindia.com
Investor can also request for physical or electronic copy of the half-yearly statement of its schemes portfolio through any of the following means
a. **SMS:** Send SMS to '5607090' from investor's registered mobile number. SMS format HYP <Folio> Example HYP '123456789' to 5607090.
b. **Telephone:** Give a call to our Contact Centre on 18002661230 (Toll Free). Landline-022-62278000
c. **Email:** Send an email to 'service@uti.co.in'
d. **Letter:** Submit a request letter at any of our UFCs/OPAs quoting your folio no. List of UFCs available at www.utimf.com.

Mumbai
October 09, 2025
Toll Free No.: 1800 266 1230
www.utimf.com

REGISTERED OFFICE: UTI Tower, 'Gn' Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051. Phone: 022 - 66786666. UTI Asset Management Company Ltd. (Investment Manager for UTI Mutual Fund) E-mail: invest@uti.co.in. (CIN-L65991MH2002PLC137867).
For more information, please contact the nearest UTI Financial Centre or your AMFI/ NISM certified Mutual fund distributor, for a copy of Statement of Additional Information, Scheme Information Document and Key Information Memorandum cum Application Form.
Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

**JSW Steel Limited**
CORPORATE IDENTIFICATION NO. (CIN) : L27102MH1994PLC152925
Regd. Office: JSW Centre, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051
Tel.: 022-4286 1000 Fax: 022-4286 3000 Email: jswl.investor@jsw.in Website: www.jsw.in

SAKSHAM NIVESHAK CAMPAIGN
Pursuant to the initiative of the Investor Education and Protection Fund Authority ("IEPFA"), Ministry of Corporate Affairs ("MCA"), and in accordance with its circular dated July 16, 2025, the Company, in association with its Registrar and Share Transfer Agent i.e. KFin Technologies Limited ("KFin"/"RTA"), has launched a 100-day campaign titled "Saksham Niveshak" from July 28, 2025 to Nov 6, 2025. The primary objective of this campaign is to encourage and facilitate shareholders to update their KYC details, bank mandates, and contact information for seamless credit of unclaimed dividends and shares. The ISR forms required for KYC updation can be downloaded from the link provided in the table below.
Shareholders are hereby informed that the details of unpaid/unclaimed dividend lying with the Company are available on the Company's website. The same can be accessed by following the link as mentioned in the table below.

Sr. No.	Particulars	Details
1	Form for KYC of Physical Folios	Link for KYC forms https://www.jswsteel.in/investors/downloads
2	Form for KYC of Demat Folios	Please contact your Depository Participant
3	Details of unpaid / unclaimed dividend lying with Company	Link for unpaid / unclaimed dividend https://www.jswsteel.in/investors/jsw-steel-governance-and-regulatory-information-shareholders-information
4	Contact Details of Registrar and Share Transfer Agent	Kfin Technologies Limited Unit : JSW Steel Limited, Selenium, Tower B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serlingampally, Hyderabad, Rangareddi, Telangana - 500032 Toll Free Number - 1800-309-4001 Email - enward.rs@kfintech.com Email for senior citizen - senior.citizen@kfintech.com
5	Contact Details of the Company	JSW Steel Limited, JSW Centre, Bandra Kurla Complex, Bandra (East), Mumbai - 400 051, Email - jswl.investor@jsw.in

We request shareholders to take advantage of the initiative of the Investor Education and Protection Fund Authority and claim their unclaimed shares and dividends.

For JSW Steel Limited
Sd/-
Manoj Prasad Singh
Company Secretary
(in the interim capacity)
Membership No. FCS 4231

Place : Mumbai
Date : October 9, 2025

**BLS International Services Limited**
CIN: L51909DL1983PLC016907
Regd. Office: G-4, B-1, Extension, Mohan Co-operative Industrial Estate, Mathura Road, New Delhi-110044, Tel. No.: 011-45795002, Email: compliance@blsinternational.net, Website: www.blsinternational.com

NOTICE TO SHAREHOLDERS
100 DAYS CAMPAIGN - "SAKSHAM NIVESHAK"
Pursuant to letter dated July 16, 2025 issued by Ministry of Corporate Affairs (MCA), Investor Education and Protection Fund Authority (IEPFA), has initiated 100 days Campaign "Saksham Niveshak" starting from July 28, 2025 to November 6, 2025 to reach out to investors/ shareholders whose dividend has remain unpaid/unclaimed and whose Know Your Customer (KYC) records or other details have not been updated.
In line with this initiatives, the investors/ shareholders of BLS International Services Limited, who have unpaid/unclaimed dividend on equity shares and/or shareholders whose KYC details have not been updated are requested to contact the Company Registrar and Transfer agent at below mentioned detail
Registrar and Share Transfer Agent
BEETAL FINANCIAL & COMPUTER SERVICES (P) LTD.
Beetal House, 3rd Floor, 99 Madangir, behind LSC, near Dada Harsukhdas Mandir, New Delhi - 110062
Mobile No. 011-29961281-83
Email: beetal@beetalfinancial.com
Procedure for updating KYC:
• **For shares held in physical Form** - Submit Investor Service Request Forms (ISR-1, ISR-2, ISR-3 or SH-13) supported by self-attested copies of PAN, Aadhaar, latest Address proof and original cancelled cheque leaf of bank account, through any of the following modes:
a. Hard copies to our RTA, M/s. Beetal Financial & Computer Services (P) Ltd, at abovementioned address; OR
b. Scanned copies to our RTA at beetal@beetalfinancial.com provided they are sent through their registered E-mail Address.
• **For shares held in demat form** - update the KYC details with their respective depository Participants (DP) and submits the self-attested copy of the updated client Master List to Company's RTA.
Procedure along with the ISR forms are available on the website of the company at <https://www.blsinternational.com> and the RTA at <https://www.beetalfinancial.com/>.
The unclaimed/unpaid dividend(s) will be credited to the respective Shareholders Bank account only after the KYC details are updated. Details of shares due for transfer to IEPF Authority and unclaimed dividend(s) are available on the website of the Company at <https://www.blsinternational.com/unclaimed-dividend>
Shareholders may also reach out to the Company at compliance@blsinternational.net or raise a service request at beetal@beetalfinancial.com.

For BLS International Services Limited
Sd/-
Dharak Mehta
Company Secretary & Compliance Officer

Date : October 09, 2025
Place : New Delhi

**MIRAE ASSET**
Mutual Fund

NOTICE CUM ADDENDUM NO. AD/67/2025
Disclosure of Half Yearly Portfolio for the period ended September 30, 2025 for the schemes of Mirae Asset Mutual Fund:
NOTICE is hereby given to all investor(s) / unit holder(s) of Mirae Asset Mutual Fund ("the Fund") that in accordance with Regulation 59 (A) of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 and pursuant to Chapter 5 of SEBI Master Circular dated June 27, 2024, the half yearly portfolio for the period ended September 30, 2025 has been hosted on AMC website i.e. www.miraeassetmf.co.in and on AMFI i.e. www.amfiindia.com.
Investors can request for physical / soft copy of the half yearly portfolio for the year ended September 30, 2025 through any of the following means:
1. Email: customercare@miraeasset.com;
2. Toll free number: 1800-2090-777 (Within India); 022-67800300 (From abroad);
3. SMS 'PORT' to 9289200052 from your registered Mobile number
4. Letter: Written request letter can be sent at KFin Technologies Limited, Karvy Selenium, Tower B, Plot Number 31 & 32, Financial District, Gachibowli, Hyderabad - 500 034.
For and on behalf of the Board of Directors of
MIRAE ASSET INVESTMENT MANAGERS (INDIA) PVT. LTD.
(Asset Management Company for Mirae Asset Mutual Fund)


Place : Mumbai
Date : October 09, 2025
Sd/-
AUTHORISED SIGNATORY
MIRAE ASSET MUTUAL FUND (Investment Manager: Mirae Asset Investment Managers (India) Private Limited) (CIN: U65990MH2019PTC324625). Statutory Details: Sponsor: Mirae Asset Global Investments Company Limited. Trustee: Mirae Asset Trustee Company Private Limited.
Registered & Corporate Office: 606, 6th Floor, Windsor Building, Off CST Road, Kalina, Santacruz (E), Mumbai - 400098. ☎ 1800 2090 777 (Toll free), ✉ customercare@miraeasset.com 🌐 www.miraeassetmf.co.in

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

FORM NO. URC.2
Advertisement giving notice about registration under Part 1 of Chapter XXI
[Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1) of the companies (Authorised to Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is being made to the Registrar at RoC- Pune that M/s We Care Healthcare, a Partnership Firm may be registered under Part of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.
2. The principal objects of the company are as follows:-
a) To construct, design, build, establish, acquire, assist, maintain, operate, run, develop and improve hospitals and nursing homes at the allotted site.
b) To maintain, operate, run, purchase, acquire, sell, convert, develop, improve, hold with absolute or limited rights or on lease, sublease, franchise or otherwise, medical colleges, nursing colleges, sanitariums, medical centres and institutions, clinics, dispensaries, child welfare centres, health centres, health farms, therapy centres, operation theatres, maternity homes, rehabilitation centres, pathological, analytical, testing and diagnostic laboratories, research, invention and development centres, family planning and welfare centres, X-ray, convalescence centres, MRI centres, CT scan centres, bio-imaging centres, magnetic resonance imaging centres, radiological centres or any other type of facilities for the practice of any field, branch, discipline or system of medicine and surgery; and to work as dispensing chemists, suppliers, traders and distributors of medicines, drugs, pharmaceuticals, chemicals, cosmetics and general merchandise of all types; and to buy, sell, rent, lease, import, export, trade, take on hire, repair, maintain, develop and acquire all types of medical and surgical appliances and equipment.
c) To provide, conduct, assist, encourage, initiate or promote all types of research facilities for carrying on research, discovery, improvement or development of new methods of diagnosis, understanding, prevention and treatment of diseases, both basic and applied; to acquire any patents, licenses or protective devices relating to the results of any discovery, investigation, finding or research; to acquire any process and to give licenses for the use or application of such processes or products to others and either to market the same or grant licenses to others for marketing the same; and to provide funds for research works and for scholarships, stipends, remuneration and/or other payments or aid to any person or persons engaged in research works or works connected with or conducive to research, and to endow research fellowships or grant financial assistance to persons or institutions engaged in medical research.
3. A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at Plot No. 1 & 2, Survey No. 47, Baner Gaon, Pune, Havell, Maharashtra-411045.
4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6.7, 8, Sector 5, IMT Manesar, District Gurgaon, Haryana - 122050 within 21 days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

For and on behalf of
M/s We Care Healthcare
Sd/-
Shriya Pritesh Munot (Partner)
Apulki Healthcare Private Limited (Partner)
Dated this 10th October, 2025

**Jio BlackRock Asset Management Private Limited**
(CIN - U66301MH2024PTC434200)
Registered office: Unit No: 1301, 13th Floor, Altimus Building, Plot No.130, Worli Estate, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400018, Maharashtra, India.
Website: www.jioblackrockamc.com

NOTICE NO. 01 / 2025-26
HALF YEARLY PORTFOLIO STATEMENT OF THE SCHEME(S) OF JIO BLACKROCK MUTUAL FUND
Notice is hereby given that pursuant to para 5.1 of SEBI Master Circular for Mutual Funds dated June 27, 2024, the half yearly portfolio statement of the scheme(s) of Jio BlackRock Mutual Fund ("the Fund") as on September 30, 2025, has been hosted on the website of Jio BlackRock Asset Management Private Limited viz. (<https://www.jioblackrockamc.com>) and on the website of AMFI viz. (<https://www.amfiindia.com>).
Unitholders may accordingly view / download the statements from the above-mentioned websites.
Unitholders can also submit a request for physical or electronic copy of the Half Yearly Portfolio Statement of the scheme(s) of the Fund through the following modes/options:
1. **Telephone:** Contact us at our Customer Care Centre at +91 22-35207700 & +91 22-69987700 (Monday - Friday, 9 a.m. - 6 p.m. & Saturday, 9 a.m. - 1 p.m.); or
2. **E-mail:** Send us an e-mail at service@jioblackrockamc.com from registered e-mail id; or
3. **Letter:** Submit a request letter at any of the Official Point of Acceptance ('OPA') of the schemes of the Fund. Investors can visit our website i.e. www.jioblackrockamc.com for the updated list of OPA.
For and on behalf of **Jio BlackRock Asset Management Private Limited (Investment Manager to Jio BlackRock Mutual Fund)**

Place : Mumbai
Date : October 09, 2025
Sd/-
Authorised Signatory

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

Continued from Previous Page

Sr. No.	No. of Shares applied for (Category wise)	Number of applications received	% to Total	Total No. of Shares applied in each category	% to Total	Proportionate shares available	Allocation per Applicant	Ratio of allottees to applicants	Number of successful applicants (after rounding off)	% to total	Total No. of Shares allocated/ allotted	% to total	Surplus/ Deficit		
1	3,000	6	42.86	18,000	30.51	3,54,429	59,071.50	3,000	1	1	6	42.86	18,000	30.51	-3,36,429
2	4,000	5	35.71	20,000	33.90	2,95,357	59,071.40	4,000	1	1	5	35.71	20,000	33.90	-2,75,357
3	7,000	3	21.43	21,000	35.59	1,77,214	59,071.33	7,000	1	1	3	21.43	21,000	35.59	-1,56,214
GRAND TOTAL		14	100.00	59,000	100.00	8,27,000			14	100.00	59,000	100.00	-7,68,000		

3) Allocation to Non-Institutional Investors-II (More than ₹10,00,000) (After rejections and withdrawals): The Basis of Allotment to the Non-Institutional Investors-II (More than ₹10,00,000) who have bid at or above the Issue Price of ₹ 121.00/- per equity shares, was finalized in consultation with BSE. Based on Revised Subscription (Times) in relation to shares allotted, the category was subscribed by 1.00 time i.e., for 18,95,000 Equity Shares. Total number of shares allotted in this category is 18,95,000 Equity Shares to 13 successful applicants. The category wise details of the Basis of Allotment are under:

Sr. No.	No. of Shares applied for (Category wise)	Number of applications received	% to Total	Total No. of Shares applied in each category	% to Total	Proportionate shares available	Allocation per Applicant	Ratio of allottees to applicants	Number of successful applicants (after rounding off)	% to total	Total No. of Shares allocated/ allotted	% to total	Surplus/ Deficit		
1	8,000	1	7.69	8,000	0.42	145769	145769.23	8,000	1	1	1	7.69	8,000	0.42	0
2	10,000	2	15.38	10,000	1.06	291538	145769.23	10,000	1	1	2	15.38	10,000	1.06	0
3	14,000	1	7.69	14,000	0.74	145769	145769.23	14,000	1	1	1	7.69	14,000	0.74	0
4	20,000	2	15.38	20,000	2.11	291538	145769.23	20,000	1	1	2	15.38	20,000	2.11	0
5	30,000	1	7.69	30,000	1.58	145769	145769.23	30,000	1	1	1	7.69	30,000	1.58	0
6	50,000	1	7.69	50,000	2.64	145769	145769.23	50,000	1	1	1	7.69	50,000	2.64	0
7	71,000	1	7.69	71,000	3.75	145769	145769.23	71,000	1	1	1	7.69	71,000	3.75	0
8	1,42,000	1	7.69	1,42,000	7.49	145769	145769.23	1,42,000	1	1	1	7.69	1,42,000	7.49	0
9	1,70,000	1	7.69	1,70,000	8.97	145769	145769.23	1,70,000	1	1	1	7.69	1,70,000	8.97	0
10	3,50,000	1	7.69	3,50,000	18.47	145769	145769.23	3,50,000	1	1	1	7.69	3,50,000	18.47	0
11	10,00,000	1	7.69	10,00,000	52.77	145769	145769.23	10,00,000	1	1	1	7.69	10,00,000	52.77	0
GRAND TOTAL		13	100.00	18,95,000	100.00	1895000			13	100.00	18,95,000	100.00	0		

4) Allocation to QIBs (After rejections and withdrawals): The Basis of Allotment to QIBs, who have bid at the Issue Price of ₹ 121.00/- per equity shares, was finalized in consultation with BSE. Based on Revised Subscription (Times) in relation to shares allotted, the category was subscribed by 1.00 time i.e., for 13,51,000 Equity Shares. Total number of shares allotted in this category is 13,51,000 Equity Shares to 7 successful applicants. The category wise details of the Basis of Allotment are under:

Sr. No.	No. of Shares applied for (Category wise)	Number of applications received	% to Total	Total No. of Shares applied in each category	% to Total	Proportionate shares available	Allocation per Applicant	Ratio of allottees to applicants	Number of successful applicants (after rounding off)	% to total	Total No. of Shares allocated/ allotted	% to total	Surplus/ Deficit		
1	34,000	1	14.29	34,000	2.52	34,001	34,000	34,000	1	1	1	14.29	34,000	2.52	0
2	53,000	2	28.57	53,000	7.85	1,05,999	53,000	53,000	1	2	28.57	53,000	7.85	0	
3	71,000	1	14.29	71,000	5.26	71,000	71,000	71,000	1	1	1	14.29	71,000	5.26	0
4	1,42,000	1	14.29	1,42,000	10.51	1,42,000	1,42,000	1,42,000	1	1	1	14.29	1,42,000	10.51	0
5	4,27,000	1	14.29	4,27,000	31.61	4,27,000	4,27,000	4,27,000	1	1	1	14.29	4,27,000	31.61	0
6	5,71,000	1	14.29	5,71,000	42.26	5,71,000	5,71,000	5,71,000	1	1	1	14.29	5,71,000	42.26	0
GRAND TOTAL		7	100.00	13,51,000	100.00	13,51,000			7	100.00	13,51,000	100.00	0		

5)Allocation to Market Maker (After Rejections): The Basis of Allotment to Market Maker who have bid at Issue Price of ₹ 121.00/- per Equity Shares or above, was finalized in consultation with BSE. The category was subscribed by 1.00 time i.e., for 2,65,000 Equity shares. The total number of shares allotted in this category is 2,65,000 Equity Shares. The category wise details of the Basis of Allotment are as under:

Sr. No.	No. of Shares applied for (Category wise)	Number of applications received	% to Total	Total No. of Shares applied in each category	% to Total	Proportionate shares available	Allocation per Applicant	Ratio of allottees to applicants	Number of successful applicants (after rounding off)	% to total	Total No. of Shares allocated/ allotted	% to total	Surplus/ Deficit		
1	2,65,000	1	100.00	2,65,000	100.00	2,65,000	2,65,000	2,65,000	1	1	1	100.00	2,65,000	100.00	0
GRAND TOTAL		1	100.00	2,65,000	100.00	2,65,000			1	100.00	2,65,000	100.00	0		

The Board of Directors of the Company at its meeting held on October 08, 2025 has approved the Basis of Allocation of Equity Shares as approved by the Designated Stock Exchange viz. BSE and has authorized the corporate action for issue of the Equity Shares to various successful applicants. The Allotment Advice Cum Refund Intimation will be dispatched to the address of the investors as registered with the depositories. Further, instructions to the SCSBs have been dispatched mailed for unlocking of funds and transfer to the public issue Account on or before October 09, 2025. In case the same is not received within ten days, Investors may contact the registrar to the issue at the address given below. The Equity Shares allotted to the successful allottees shall be uploaded on or before October 09, 2025 for credit in to the respective beneficiary accounts subject to validation of the account details with the depositories concerned. The Company is in the process of obtaining the Listing and Trading approval from BSE and the trading of Equity shares is expected to commence on October 10, 2025.


6)Allocation to Lead Manager as Underwriters Obligation (After Technical Rejections & Withdrawal): The Basis of Allotment to Book Running Lead Manager and the Underwriter as Underwriters Obligation, at the issue price of Rs. 121.00 per Equity Share, was finalized in consultation with BSE. The issue is 100% underwritten and hence the unsubscribed portion of 12,24,000 Equity Shares under the categories of Individual Investors applied for minimum application size (2 Lots) And Non-Institutional Bidders+1 (More than 2 lots & up to ₹10,00,000) was subscribed as per Book Running Lead Manager and Underwriter as Underwriters Obligation at the Issuer Price of Rs. 121.00 per Equity Share. The Book Running Lead Manager and Underwriter to the issue has fulfilled their respective underwriting obligation in their own respective account as per the Devolvement Notice dated October 08, 2025 and in consultation with BSE. The category was subscribed by 1.00 times i.e. for 12,24,000 shares. The total number of shares allotted in this category is 12,24,000 Equity Shares to 2 successful applicants. The category wise details of the Basis of Allotment are as under:

Sr. No.	No. of Shares applied for (Category wise)	Number of applications received	% to Total	Total No. of Shares applied in each category	% to Total	Proportionate shares available	Allocation per Applicant	Ratio of allottees to applicants	Number of successful applicants (after rounding off)	% to total	Total No. of Shares allocated/ allotted	% to total	Surplus/ Deficit		
1	1,84,000	1	50.00	1,84,000	1,84,000	1,84,000	1,84,000	1,84,000	1	1	1	50.00	1,84,000	15.03	0
2	10,40,000	1	50.00	10,40,000	10,40,000	10,40,000	10,40,000	10,40,000	1	1	1	50.00	10,40,000	84.97	0
GRAND TOTAL		2	100.00	12,24,000	100.00	12,24,000			2	100.00	12,24,000	100.00	0		

Note: All capitalized terms used and not defined herein shall have the respective meanings assigned to them in the prospectus dated October 08, 2025 filed with the Registrar of Companies, Gwalior ("ROC") and Corrigendum dated September 19, 2025 and September 25, 2025 to Red Herring Prospectus.

INVESTORS PLEASE NOTE

The details of the allotment made would also be hosted on the website of the Registrar to the issue, Bigshare Services Private Limited at www.bigshareonline.com. All future correspondence in this regard may kindly be addressed to the Registrar to the Issue quoting full name of the First/ Sole Bidder Serial number of the ASBA form, number of Equity Shares bid for, Bidder DP ID, Client ID, PAN, date of submission of the Bid cum Application Form, address of the Bidder, the name and address of the Designated Intermediary where the Bid cum Application Form was submitted by the Bidder and copy of the Acknowledgment Slip received from the Designated Intermediary and payment details at the address given below:



BIGSHARE SERVICES PRIVATE LIMITED
Address: S6-2, 6th Floor, Pinnacle Business Park, Mahakali Caves Road,
Next to Ahura Centre, Andheri East, Mumbai - 400 093, Maharashtra, India
Telephone No.: + 91 22 6263 8200
Email: ipo@bigshareonline.com
Website: www.bigshareonline.com
Contact Person: Babu Rapheal C.
SEBI Registration No.: INR000001385

For, NSB BPO Limited
On behalf of Board of Directors
Sd/-
Vikrant Singhal
Designation: Managing Director
DIN: 02171429

Date: October 09, 2025
Place: Noida

THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES ON LISTING OR THE BUSINESS PROSPECTS OF NSB BPO LIMITED.

Disclaimer: NSB BPO Limited is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public issue of its Equity Shares and has filed the Prospectus with the Registrar of Companies, Gwalior on October 08, 2025 and thereafter with SEBI and the Stock Exchanges. The Prospectus is available on the websites of SEBI at www.sebi.gov.in, website of the Company at www.nsbipo.com, and the Book Running Lead Manager at www.investoremerchanbanker.com, the website of the BSE i.e. www.bseindia.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, please refer to the Prospectus including the section titled "Risk Factors" beginning on page 24 of the Prospectus. Investor should note that investment in equity shares involves a high degree of risk. For details, investors should refer to and rely on the Prospectus, including the section titled "Risk Factors" of the Prospectus, which has been filed with ROC. The Equity Shares have not been and will not be registered under the US Securities Act of 1933, as amended ("the Securities Act") or any state securities laws in United States and may not be issued or sold within the United States or to, or for the account or benefit of, "U.S. persons" (as defined in Regulations under the securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act of 1933 and in accordance with any applicable U.S. state securities laws. The Equity Shares are being Offered and sold outside the United States in "offshore transactions" in reliance on Regulation S under the Securities Act and the applicable laws of each jurisdiction where such Offers and sales are made. There will be no public offering in the United States.

Surgeet.com

આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ

(જુની ડેવિટેલ ફર્સ્ટ લીમીટેડ અને આઈડીએફસી બેંક લીમીટેડ સાથે અમાલગમેટેડ)

CIN : L65110TN2014PLC097792

રજીસ્ટર્ડ ઓફીસ : ડેઆરએમ ટાવર્સ, આઠમો માળ, હેરિટાજ રોડ, ચેટપેટ, રજીસર્ડ ઓફીસ : +૯૧ ૪૪ ૪૫૬૪ ૪૦૦૦, ફેક્સ : +૯૧ ૪૪ ૪૫૬૪ ૪૦૨૨

પરિચિત્ત જ (નિયમ ૮(૧))

કંપનિ નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ (જુની ડેવિટેલ ફર્સ્ટ લીમીટેડ અને આઈડીએફસી બેંક લીમીટેડમાં અમાલગમેટેડ) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિસ્ટોરીટી ઇન્સ્ટ્રમેન્ટ અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિસ્ટોરીટી ઇન્સ્ટ્રમેન્ટ, ૨૦૦૨ હેઠળ અને સિસ્ટોરીટી ઇન્સ્ટ્રમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને તારીખ ૧૪.૦૬.૨૦૨૫ ના રોજ માંગણા નોટીસ જારી કરીને ૧. શ્રી મગાજી હાકોર, ૨. શ્રીમતી કાકોર લલિતાબેનને નોટીસમાં જણાવેલ રકમ રૂ. ૭,૫૧,૮૧૯.૮૨/- (રૂપિયા સાત લાખ એકાદશ હજાર આઠસો ઓગણીસ અને બ્વાસી પૈસા પુરા) ૧૩.૦૬.૨૦૨૫ મુજબ આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું.

દેવાદારે રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, દેવાદાર અને જાહેર જનતાને આથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે સિસ્ટોરીટી ઇન્સ્ટ્રમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ મિલકતનો કંપને ૦૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ વતી લીધો છે.

આથી ખાસ કરીને દેવાદારો અને જાહેર જનતાને આથી આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ (જુની ડેવિટેલ ફર્સ્ટ લીમીટેડ અને આઈડીએફસી બેંક લીમીટેડમાં અમાલગમેટેડની રકમ રૂ. ૭,૫૧,૮૧૯.૮૨/- (રૂપિયા સાત લાખ એકાદશ હજાર આઠસો ઓગણીસ અને બ્વાસી પૈસા પુરા) અને તેના પરના વ્યાજના સર્જને આદિન રહેશે.

સિસ્ટર્ડ મિલકત પર મેટ મેગવવા માટે ઉપલબ્ધ સમયાના સંબંધમાં, એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવા આવે છે.

સ્થાવર મિલકતની વિગત

મિલકત નં. ૪૪૫, જુનો મિલકત નં. ૩૩૫, ફોરફાઇ ૧૫X૪૫x૬૫.૦૦ ચો. ફુટ (૬૨.૦૦૪૫ ચો.મી.), મુકામ-ગામ-સુરુષ્ટ, તાલુકો-ઉડાપ, જિલ્લો-હેતસાવા, ગુજરાત, ભારત-૩૮૨૧૪૦ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુર્સીમા : પૂર્વ : હાકોર બધાજુ નેનાજીનું ઘર, પશ્ચિમ : હાકોર કેનાજુ નેનાજીનું ઘર, ઉત્તર : રસ્તો, દક્ષિણ : રસ્તો. તેમજ તેમાં હલો, રસ્તાગથા અને મંચુરીઓ, તેના પરની વર્તમાન અને ભાવી બિલ્ડીંગો, સ્ટ્રક્ચર્સ, સુધાર અને/અથવા તેના પરના માંગણાઓ અને વ્યાર પછીના ડેવલોપમેન્ટ્સ અને જમીન સાથે કાયમી રીતે સંકળાયેલ પલાન્ટ અને મશીનરીઓ, વર્તમાન અને ભાવી બંને.

સહી/- અધિકૃત અધિકારી

આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ

સ્થાન : ગુજરાત

(જુની ડેવિટેલ ફર્સ્ટ લીમીટેડ અને આઈડીએફસી બેંક લીમીટેડ સાથે અમાલગમેટેડ)

તારીખ : ૦૭.૧૦.૨૦૨૫

સ્થાન : ગુજરાત

લોન એકાઉન્ટ નં. : ૧૦૩૮૬૩૭૩૮

આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ

(જુની ડેવિટેલ ફર્સ્ટ લીમીટેડ, આઈડીએફસી બેંક લીમીટેડ સાથે અમાલગમેટેડ અને હાલમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ તરીકે જાણીતી)

CIN : L65110TN2014PLC097792

રજીસ્ટર્ડ ઓફીસ : ડેઆરએમ ટાવર્સ, આઠમો માળ, હેરિટાજ રોડ, ચેટપેટ, રજીસર્ડ ઓફીસ : +૯૧ ૪૪ ૪૫૬૪ ૪૦૦૦, ફેક્સ : +૯૧ ૪૪ ૪૫૬૪ ૪૦૨૨

સિસ્ટોરીટીઈજેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિસ્ટોરીટી ઇન્સ્ટ્રમેન્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ નોટીસ

નીચે જણાવેલ દેવાદારો અને સહ-દેવાદારોએ આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ (જુની ડેવિટેલ ફર્સ્ટ લીમીટેડ, આઈડીએફસી બેંક લીમીટેડ સાથે અમાલગમેટેડ અને હાલમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ તરીકે જાણીતી) પાસેથી નીચે જણાવેલ સિસ્ટોરી લોન લીધી હતી. નીચે જણાવેલ દેવાદાર અને સહ-દેવાદારોની લોનો તેમની સંબંધિત મિલકતના ગૌરો દ્વારા સિસ્ટોરી લોન લીધી હતી. તેઓ સંબંધિત લોન એકીમે-ટોની જરૂતો અને નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા હોવાથી અને અનિચ્છામિત બન્યા હોવાથી, તેમની લોન આરબીઆઈ માર્ગદર્શિકાઓ મુજબ એન્પીએ તરીકે વર્ગીકૃત કરાઈ હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ, આઈડીએફસી બેંક લીમીટેડ સાથે અમાલગમેટેડ અને હાલમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ તરીકે જાણીતી) પ્રત્યેની તેમની બાકી રકમો જારી કરાવેલ સંબંધિત નોટીસો મુજબ છે. જે વધુ વિગતવાર નીચેના ફોર્મમાં દર્શાવેલ છે અને આ રકમો પરનું ચકત રજાબ પણ લાગુ રહેશે અને તે તેમની સંબંધિત તારીખો થી કારનારા દરે ચાર્જ કરવામાં આવશે.

ક્રમ	લોન એકાઉન્ટ નં.	લોનનો પ્રકાર	દેવાદાર અને સહ-દેવાદારના નામ	નિયમ ૧૩(૨) નોટીસની તારીખ	નિયમ ૧૩(૨) નોટીસ મુજબ બાકી રકમ
૧	૨૭૨૯૫૮૬૧	મિલકત સામે લોન	૧. કિરોદેસખાન પહાણ, ૨. બહિરખાન પહાણ, ૩. કિરોદેસખાન બહિરખાન પહાણ	૧૭.૦૮.૨૦૨૫	રૂ. ૨૧,૫૬,૯૬૭.૦૫/-

મિલકતનું સરનામું : ગામ ઓથોરિટી મિલકત નં. ૫૮૧, અમદાવાદ એરિયા ૫૪૦.૦૦ ચો. ફુટ, મુકામ-પીર કેટી પાસે, તમસા, તાલુકો-ઉમરેડ, જિલ્લો-આણંદ, ગુજરાત-૩૮૨૨૫ ખાતેની રેસિડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુર્સીમા : પૂર્વ : રોડ, ઉત્તર : નટુભાઈ ખોડાભાઈ પટેલની ખુલી જમીન, પશ્ચિમ : રોડ, દક્ષિણ : મહેલખાન રસુલખાન પહાણનું ઘર

૨	૬૩૧૧૮૮૫૬	મિલકત સામે લોન	૧. સરિયા જ્યોતેશભાઈ રાજુભાઈ, ૨. સરિયા રાજુભાઈ સુરભાઈ	૦૪.૦૮.૨૦૨૫	રૂ. ૩,૮૮,૪૭૪.૪૫/-
---	----------	----------------	--	------------	-------------------

મિલકતનું સરનામું : ગામતણા ગામ પંચાયત મિલકત નં. ૧/૮૮, એરિયા ફોરફાઇ આશરે ૬૦-૭૨ આશરે એગ્રીગેટિંગ ફોરફાઇ આશરે ૧૯૨૦ ચો. ફુટ, જમીન મોજે/ગામ-માલનપુર, તાલુકો-પારડી, અને જિલ્લો-સુરેન્દ્રનગર, ગુજરાત ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુર્સીમા : પૂર્વ : બાબાભાઈ ભરવાડનું ઘર, પશ્ચિમ : બાબાભાઈ ભરવાડનું ઘર, ઉત્તર : જાહેર રોડ, દક્ષિણ : શાકતભાઈ ભરવાડનું ઘર

આથી તમને અહીં ઉપર ફોરફાઈ જણાવેલ વિગતો મુજબ તેમજ સંબંધિત તારીખોથી તેના પરના કારનારા દરે ચકત વ્યાજ અને અન્ય કસ્ટોમર, ચાર્જિસ વગેરે સહીત આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ (જુની ડેવિટેલ ફર્સ્ટ લીમીટેડ, આઈડીએફસી બેંક લીમીટેડ સાથે અમાલગમેટેડ અને હાલમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ તરીકે જાણીતી) ની રકમો આ પ્રકાશનની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવમાં આવે છે, જેમાં નિષ્ફળ પત્તી નથી સહી કરનારને આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ (જુની ડેવિટેલ ફર્સ્ટ લીમીટેડ, આઈડીએફસી બેંક લીમીટેડ સાથે અમાલગમેટેડ અને હાલમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ તરીકે જાણીતી) ની બાકી રકમની વસતીવા માટે અહીં ઉપર જણાવેલ ગૌરો મિલકતી સામે, સરકારી એક્ટની કલમ ૧૩(૪) અને કલમ ૧૪ હેઠળ કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડશે. આ ઉપરાંત તમને વેચાણ/બેંક અથવા અન્ય રીતે જણાવેલ સિસ્ટોરી મિલકતો ટ્રાન્સફર કરવામાં જણાવેલ એક્ટની કલમ ૧૩(૧૩) હેઠળ મનાઈ કરવામાં આવે છે.

સહી/- અધિકૃત અધિકારી

આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ

(જુની ડેવિટેલ ફર્સ્ટ લીમીટેડ, આઈડીએફસી બેંક લીમીટેડ સાથે અમાલગમેટેડ અને હાલમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક લીમીટેડ તરીકે જાણીતી)

તારીખ : ૧૦.૧૦.૨૦૨૫

સ્થાન : ગુજરાત

The Board of Directors of the Company at its meeting held on October 08, 2025 has approved the Basis of Allocation of Equity Shares as approved by the Designated Stock Exchange viz. BSE and has authorized the corporate action for issue of the Equity Shares to various successful applicants. The Allotment Advice Cum Refund Intimation will be dispatched to the address of the investors as registered with the depositories. Further, instructions to the SCsBs have been dispatched mailed for unlocking of funds and transfer to the public issue Account on or before October 09, 2025. In case the same is not received within ten days, Investors may contact the registrar to the issue at the address given below. The Equity Shares allotted to the successful allottees shall be uploaded on or before October 09, 2025 for credit in to the respective beneficiary accounts subject to validation of the account details with the depositories concerned. The Company is in the process of obtaining the Listing and Trading approval from BSE and the trading of Equity shares is expected to commence on October 10, 2025.

6)Allocation to Lead Manager as Underwriters Obligation (After Technical Rejections & Withdrawal): The Basis of Allotment to Book Running Lead Manager and the Underwriter as Underwriters Obligation, at the issue price of Rs. 121.00 per Equity Share, was finalized in consultation with BSE. The Issue is 100% underwritten and hence the unsubscribed portion of 12,24,000 Equity Shares under the categories of Individual Investors applied for minimum application size (2 Lots) And Non-Institutional Bidders-I (More than 2 lots & up to ₹10,00,000) was subscribed as per Book Running Lead Manager and Underwriter as Underwriters Obligation at the Issuer Price of Rs. 121.00 per Equity Share. The Book Running Lead Manager and Underwriter to the Issue has fulfilled their respective underwriting obligation in their own respective account as per the Devolvement Notice dated October 08, 2025 and in consultation with BSE. The category was subscribed by 1.00 times i.e. for 12,24,000 shares. The total number of shares allotted in this category is 12,24,000 Equity Shares to 2 successful applicants. The category wise details of the Basis of Allotment are as under:

Sr. No.	No. of Shares applied for (Category wise)	Number of applications received	% to Total	Total No. of Shares applied in each category	% to Total	Proportionate shares available	Allocation per Applicant		Ratio of allottees to applicants		Number of successful applicants (after rounding off)	% to total	Total No. of Shares allocated/ allotted	% to total	Surplus/ Deficit
1	1,84,000	1	50.00	1,84,000	1,84,000	1,84,000	1,84,000	1,84,000	1	1	1	50.00	1,84,000	15.03	0
2	10,40,000	1	50.00	10,40,000	10,40,000	10,40,000	10,40,000	10,40,000	1	1	1	50.00	10,40,000	84.97	0
GRAND TOTAL		2	100.00	12,24,000	100.00	12,24,000					2	100.00	12,24,000	100.00	0

Note: All capitalized terms used and not defined herein shall have the respective meanings assigned to them in the Prospectus dated October 08, 2025 filed with the Registrar of Companies, Gwalior ("RoC") and Corrigendum dated September 19,2025 and September 25,2025 to Red Herring Prospectus.

INVESTORS PLEASE NOTE

The details of the allotment made would also be hosted on the website of the Registrar to the issue, Bigshare Services Private Limited at www.bigshareonline.com. All future correspondence in this regard may kindly be addressed to the Registrar to the Issue quoting full name of the First/ Sole Bidder Serial number of the ASBA form, number of Equity Shares bid for, Bidder DP ID, Client ID, PAN, date of submission of the Bid cum Application Form, address of the Bidder, the name and address of the Designated Intermediary where the Bid cum Application Form was submitted by the Bidder and copy of the Acknowledgment Slip received from the Designated Intermediary and payment details at the address given below:

BIGSHARE SERVICES PRIVATE LIMITED

Address: S6-2, 6th Floor, Pinnacle Business Park, Mahakali Caves Road, Next to Ahura Centre, Andheri East, Mumbai - 400 093, Maharashtra, India

Telephone No.: +91 22 6263 8200

Email: ipo@bigshareonline.com

Website: www.bigshareonline.com

Contact Person: Babu R